
Bharata Kavacham

भरतकवचम्

Document Information

Text title : bharata kavacham

File name : bharatakavachaAnanda.itx

Category : kavacha, raama, vAlmIki

Location : doc_raama

Author : Valmiki

Transliterated by : Antaratma antaratma at Safe-mail.net

Proofread by : Antaratma antaratma at Safe-mail.net

Description-comments : from Anandaramayana

Latest update : January 30, 2021

Send corrections to : Sanskrit@cheerful.com


This text is prepared by volunteers and is to be used for personal study and research. The file is not to be copied or reposted without permission, for promotion of any website or individuals or for commercial purpose.

Please help to maintain respect for volunteer spirit.

Please note that proofreading is done using Devanagari version and other language/scripts are generated using **sanscript**.

January 30, 2021

sanskritdocuments.org



Bharata Kavacham

ભરતકવચમ્



અગસ્તિરુવાચ-

અતઃ પરં ભરતસ્ય કવચં તે વદામ્યહમ્ ।
સર્વપાપહરં પુણ્યં સદા શ્રીરામભક્તિદમ્ ॥ ૧ ॥

કૈકેયીતનયં સદા રઘુવરન્યસ્તેક્ષણં શ્યામલં
સમદ્વીપપતેર્વિદેહતનયાકાન્તસ્ય વાક્યે રતમ્ ।
શ્રીસીતાધવસવ્યપાર્શ્વનિકટે સ્થિત્વા વરં ચામરં
ધૃત્વા દક્ષિણસત્કરેણ ભરતં તં વીજયન્તં ભજે ॥ ૨ ॥

ૐ અસ્ય શ્રીભરતકવચમન્ત્રસ્ય અગસ્ત્ય ઋષિઃ ।
શ્રીભરતો દેવતા । અનુષ્ટુપ્ છન્દઃ । શડ્ભ ઇતિ બીજમ્ ।
કૈકેયીનન્દન ઇતિ શક્તિઃ । ભરતખાણ્ડેશ્વર ઇતિ કીલકમ્ ।
રામાનુજ ઇત્યસ્ત્રમ્ । સમદ્વીપેશ્વરદાસ ઇતિ કવચમ્ ।
રામાંશજ ઇતિ મન્ત્રઃ ।
શ્રીભરતપ્રીત્યર્થં સકલમનોરથસિદ્ધ્યર્થં જપે વિનિયોગઃ ॥

અથ અડ્ગુળીન્યાસઃ -

ૐ ભરતાય અડ્ગુષ્ઠાભ્યાં નમઃ ।
ૐ શડ્ખાય તર્જનીભ્યાં નમઃ ।
ૐ કૈકેયીનન્દનાય મધ્યમાભ્યાં નમઃ ।
ૐ ભરતખાણ્ડેશ્વરાય અનામિકાભ્યાં નમઃ ।
ૐ રામાનુજાય કનિષ્ઠિકાભ્યાં નમઃ ।
ૐ સમદ્વીપેશ્વરદાસાય કરતલકરપૃષ્ઠાભ્યાં નમઃ ॥

હૃદયાદિન્યાસઃ -

ૐ ભરતાય હૃદયાય નમઃ ।
ૐ શડ્ખાય શિરસે સ્વાહા ।
ૐ કૈકેયીનન્દનાય શિખાયૈ વષટ્ ।

ॐ भरतभ्राउेश्वराय कवयाय हुम् ।
 ॐ रामानुजाय नेत्रत्रयाय वीषट् ।
 ॐ सप्तद्वीपेश्वरदासाय अस्त्राय कृट् ।
 ॐ रामांशजैति द्विगुण्यः ॥

अथ ध्यानम् -

रामयन्द्रसव्यपार्श्वे स्थितं केकयजासुतम् ।
 रामाय चामरेणैव वीजयन्तं मनोरमम् ॥ १ ॥

रत्नकुण्डलकेयूरकङ्कुणादिसुभूषितम् ।
 पीताम्बरपरिधानं वनमालाविराजितम् ॥ २ ॥

माण्डवीधौतयराणं रशानानूपुरान्वितम् ।
 नीलोत्पलदलश्यामं द्विजराजसमाननम् ॥ ३ ॥

आजानुभातुं भरतभ्राउेस्य प्रतिपालकम् ।
 रामानुजं स्मितास्यं य शत्रुघ्नपरिवन्धितम् ॥ ४ ॥

रामन्यस्तेक्षणं सौम्यं विद्युत्पुञ्जसमप्रभम् ।
 रामभक्तं मडावीरं वन्दे तं भरतं शुभम् ॥ ५ ॥

अेवं ध्यात्वा तु भरतं रामपादेक्षणं वृष्टि ।
 कवयं पठनीयं हि भरतस्येदमुत्तमम् ॥ ६ ॥

अथ कवयप्रारम्भः ।

ॐ पूर्वतो भरतः पातु दक्षिणे कैकयीसुतः ।
 नृपात्मजः प्रतीच्यां हि पातूदीच्यां रघूत्तमः ॥ १ ॥

अधः पातु श्यामलाङ्गः योर्ध्वं दशरथात्मजः ।
 मध्ये भारतवर्षेशः सर्वतः सूर्यवंशजः ॥ २ ॥

शिरो दक्षपिता पातु भालं पातु हरिप्रियः ।
 भ्रुवोर्मध्यं जनकजावाक्यैकतत्परोऽवतु ॥ ३ ॥

पातु जनक-जामाता मम नेत्रे सदाऽत्र हि ।
 कपोले माण्डवीकान्तः कर्णभूले स्मिताननः ॥ ४ ॥

नासाग्रं मे सदा पातु कैकेयीतोषवर्धनः ।
 उदाराङ्गो मुभं पातु वाणीं पातु जटाधरः ॥ ५ ॥

પાતુ પુષ્કરતાતો મે જિહ્વાં દન્તાન્ પ્રભામયઃ ।
 ચિબુકં વલ્કલધરઃ કણ્ઠં પાતુ વરાનનઃ ॥ ૬ ॥
 સ્કન્ધૌ પાતુ જિતારાતિભુજૌ શત્રુઘ્નવન્દિતઃ ।
 કરૌ કવચધારી ચ નખાન્ ખડ્ગધરોડવતુ ॥ ૭ ॥
 કુક્ષિં રામાનુજઃ પાતુ વક્ષઃ શ્રીરામવલ્લભઃ ।
 પાર્શ્વે રાઘવપાર્શ્વસ્થઃ પાતુ પૃષ્ઠં સુભાષણઃ ॥ ૮ ॥
 જઠરં ચ ધનુર્ધારી નાભિં શરકરોડવતુ ।
 કટિં પદ્મેક્ષણઃ પાતુ ગુહ્યં રામૈકમાનસઃ ॥ ૯ ॥
 રામમિત્રઃ પાતુ લિડ્ગમૂરૂ શ્રીરામસેવકઃ ।
 નન્દિગ્રામસ્થિતઃ પાતુ જાનુની મમ સર્વદા ॥ ૧૦ ॥
 શ્રીરામપાદુકાધારી પાતુ જડ્ઘે સદા મમ ।
 ગુલ્ફૌ શ્રીરામબન્ધુશ્ચ પાદૌ પાતુ સુરાર્ચિતઃ ॥ ૧૧ ॥
 રામાજ્ઞાપાલકઃ પાતુ મમાડ્ગાન્યત્ર સર્વદા ।
 મમ પાદાડ્ગુળીઃ પાતુ રઘુવંશસુભૂષણઃ ॥ ૧૨ ॥
 રોમાણિ પાતુ મે રમ્યઃ પાતુ રાત્રૌ સુધીર્મમ । (સુધીશ્ચ મામ્)
 તૂણીરધારી દિવસે દિક્ પાતુ મમ સર્વદા ॥ ૧૩ ॥
 સર્વકાલેષુ માં પાતુ પાઞ્ચજન્યઃ સદા ભુવિ ।
 એવં શ્રીભરતસ્યેદં સુતીક્ષણ કવચં શુભમ્ ॥ ૧૪ ॥
 મયા પ્રોક્તં તવાગ્રે હિ મહામડ્ગલકારકમ્ ।
 સ્તોત્રાણામુત્તમં સ્તોત્રમિદં જ્ઞેયં સુપુણ્યદમ્ ॥ ૧૫ ॥
 પઠનીયં સદા ભક્ત્યા રામચન્દ્રસ્ય હર્ષદમ્ ।
 પઠિત્વા ભરતસ્યેદં કવચં રઘુનન્દનઃ ॥ ૧૬ ॥
 યથા યાતિ પરં તોષં તથા સ્વકવચેન ન ।
 તસ્માદેતત્ સદા જખ્યં કવચાનામનુત્તમમ્ ॥ ૧૭ ॥
 અસ્યાત્ર પઠનાન્મર્ત્યઃ સર્વાન્ કામાનવાપ્નુયાત્ ।
 વિદ્યાકામો લભેદ્ધિદ્યાં પુત્રકામો લભેત્ સુતમ્ ॥ ૧૮ ॥
 પત્નીકામો લભેત્ પત્નીં ધનાર્થી ધનમાપ્નુયાત્ ।
 યદ્યન્મનોડમ્બિલધિતં તત્તલ્કવચપાઠતઃ ॥ ૧૯ ॥

लभ्यते मानवैरत्र सत्यं सत्यं वदाम्यहम् ।
तस्मात् सदा जपनीयं रामोपासकमानवैः ॥ २० ॥

एति श्रीशतकोटिरामचरितान्तर्गते श्रीमदानन्दरामायणे
वाल्मीकीये मनोहरकाण्डे पञ्चदशसर्गान्तर्गतं
श्रीभरतकवचं सम्पूर्णात् ॥

हनुमत्-लक्ष्मण-सीता-राम-भरत-शत्रुघ्न
षट् कवचानि पठनीयम् ।
षट् कवचानि पठितुं अशक्तश्चेत्
हनुमत्-लक्ष्मण-सीता-राम –
अथवा हनुमत्-सीता-राम
अथवा हनुमत्-राम / सीता-राम कवचानि ।
अथवा श्रीरामकवचमेव पठनीयम् ॥

All the six kavachas

hanumat-lakShmaNa-sItA-rAma-bharata-shatrughna
from AnandarAmAyaNa should be recited together.

If one is unable to recite all the six,
then he/she can recite in the decreasing order
hanumat-lakShmaNa-sItA-rAma

hanumat-sItA-rAma

hanumat-rAma

sItA-rAma


If this is not possible, then one should at least
recite Shri Rama Kavacham.

Encoded by Antaratma antaratma at Safe-mail.net

Proofread by Antaratma, PSA Easwaran



pdf was typeset on January 30, 2021

——
Please send corrections to sanskrit@cheerful.com

